

CIN: L27320GJ2016PLC094314

Ph.: +91 288 2730088 / 2730099

Mobile: +91 88666 86058 E-mail: info@poojametal.com Website: www.poojametal.com

Plot No.1, G.I.D.C. Industrial Area, Phase II, Dared, Jamnagar - 361 004 (Gujarat) INDIA

Date: September 08, 2022

To,

BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400001.

Respected Sir/Ma'am,

Sub: Newspaper Advertisement of 06th Annual General Meeting of the Members of Poojawestern Metaliks Limited. Ref: Poojawestern Metaliks Limited (Security Code/Security Id: 540727/POOJA)

With reference to caption subject, we would like to inform you that the Notice of 06th Annual General Meeting (AGM) was published on Wednesday, September 07, 2022 in "Financial Express" in English Language Newspaper and in "Financial Express" Gujarati Language Newspaper.

Further, Pursuant to Regulation 30 of SEBI (Listing Obligation and Disclosure requirement) Regulations, 2015 and Schedule III, Kindly note that the Company has completed the process of issuing notice of AGM to the members along with Annual Report For the Financial year 2021-22 and instruction for e-voting & attaining AGM through VC/OAVM on Wednesday, September 07, 2022.

Please find enclosed herewith the copy of Newspaper advertisement of the Annual General Meeting and instruction for e-voting VC/OAVM.

Please take the same on your record.

FOR, POOJAWESTERN METALIKS LIMITED

SUNIL DEVRAM DIgitally signed by SUNIL DEVRAM PANCHMATIYA Date: 2022.09.08 15:29:15 +05'30'

Sunil Devram Panchmatiya Chairman & Managing Director DIN: 02080742 Encl: a/a

THE BARODA RAYON CORPORATION LIMITED

CIN -L45100GJ1958PLC000892

Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna, Dist. Surat-394220 (T) 0261-2899555 | Email-Id - brcsurat@gmail.com Website-www.brcl.in

NOTICE OF 62nd AGM

NOTICE is hereby given that 62ndANNUAL GENERAL MEETING of the Company will be held on Wednesday, the 28th September, 2022 at 09.00 a.m. at Patidar Bhavan, Kadodara, Surat - 394327 to transact the business as set out in the Notice of the 62nd AGM.

BOOK CLOSURE NOTICE AND E-VOTING

All the shareholders of the company are informed that the member's register of the company will be closed from Thursday, 22nd September, 2022 to Wednesday 28th September, 2022 (both day inclusive) for the purpose of AGM. The Cut-off date for providing E-voting is Wednesday, 21st September, 2022. All the members are hereby informed that:

 Electronic copies of the Notice of AGM have been sent to all the members whose email IDs are registered with the Company/ Depository Participant(s). The same is available on Company's website www.brcl.in. The dispatches of Notice of AGM have been completed

Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of Wednesday, 21st September, 2022, may cast their vote electronically on the business set out in the Notice of AGM through electronic voting system of NSDL from a place other than the venue of AGM ("remote e-voting"). All the members are informed that:

i. The Businesses as set out in the Notice of AGM may be transacted through voting by electronic means;

ii. The remote e-voting shall commence on Sunday, 25th September, 2022at 09.00 a.m. (IST);

iii. The remote e-voting shall end on Tuesday, 27thSeptember, 2022 at

05.00 p.m. (IST); iv. The cut-off date for determining the eligibility to vote by electronic means at the AGM is Wednesday, 21stSeptember, 2022.

v. Any person, who acquires shares of the company and become member of the company after the dispatch of the notice of AGM and holding shares as of the cut-off date i.e. Wednesday, 21st September, 2022may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if a person is already registered with NSDL for e-voting then existing user ID and password can be used for casting vote;

vi. Members may note that: (a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; (b) the facility for voting through ballot paper shall be made available at the AGM; (c) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and (d) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall only be entitled to avail the facility of e-voting as well as voting at the AGM through ballot paper;

vii. In case of any queries or issue regarding e-voting, you can write an email to evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22

For The Baroda Rayon Corporation Limited

Place : Surat. Date: 06-09-2022

i.e. www.evoting.nsdl.com

Kunjal Desai Company Secretary

POOJAWESTERN METALIKS LIMITED

Regd Office: Plot No.1, Phase II, GIDC, Dared, Jamnagar, Gujarat - 361004, India I No: 288-2730088, Website:www.poojametal.com,Email-poojametals@gmail.c

Corporate Identity Number (CIN): L27320GJ2016PLC094314

NOTICE OF THE 06th ANNUAL GENERAL MEETING OF THE COMPANY AND E-VOTING

NOTICE is hereby given that in view of the continuing Covid-19 pandemic and in accordance with the May 5, 2020 Circular No. 02/2022 read with Circular no 2022/02 dated May 05, 2022, with Circular No. 14 dated April 8, 2020 and Circular No. 17 dated April 13, 2020 and Circular no. 02/2021 dated January 13, 2021 in relation to "Clarification on holding of annual general meeting (AGM) through video conferencing (VC) or other audio visual means (OAVM)" (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Annual General Meeting through VC or OAVM, the Sixth (6th) Annual General Meeting (AGM) of the Members of Poojawestern Metaliks Limited be held on Thursday, September 29, 2022 at 12:00 P.M. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary and Special Businesses as set out in the notice of 6th AGM.

In accordance with the General Circular No. 02/2022 dated May 05, 2022 read with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020 and General Circular No. 02/2021 dated January 13, 2021, issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 issued by the Securities Exchange Board of India (SEBI) the Notice of AGM along with Annual Report 2021-22 is being sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/ Depositories. Member may note that Notice and Annual Report 2021-22 will be uploaded on the website of the Company at www.poojametals.com, website of BSE Limited at www.bseindia.com and website of National Securities Depository Limited (NSDL)

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 06th AGM and Annual Report 2021-22 could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:

1. In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (selfattested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to info@poojametal.com

In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to info@poojametal.com.

3. Alternatively member may send an e-mail request to evoting@nsdl.co.in for obtaining User ID and Password by proving the details mentioned in Point (1) or (2) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of 06th AGM and Annual Report 2021-22 and the procedure for evoting along with the user-id and the password to enable e-voting for 06th AGM. In case of any queries, shareholder may write to the Company at info@poojametal.com. Shareholders are requested to register/ update their Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the

Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Thursday, September 22, 2022 ("Cut-off date"), shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annual General Meeting.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for

facilitating voting through electronic means. The remote e-voting will commence on 9:00 A.M. on Monday, September 26, 2022 and will end on 5:00 P.M. on Wednesday, September 28, 2022. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that

a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently;

b) the facility of e-voting shall be made available at the 06th AGM; and

c) the members who have cast their vote by remote e-voting prior to the 06th AGM may also attend the 06th AGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the 06th Annual General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Thursday, September 22, 2022 ,are requested to refer to the Notice of AGM for the process to be adopted for obtaining the USER ID and Password for

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in.Members may also contact Mr. Tejus Rameshchandra Pithadiya, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to www.poojametals.com for any further clarification.

Members can attend and participate in the Annual General Meeting through VC/OAVM facility. The instructions for joining the Annual General Meeting through VC/OAVM are provided in the Notice of the Annual General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM, you can write an email to evoting@nsdl.co.in or Call us: - Tel: 1800-222-990. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

For, Pooja Western Metaliks Limited

Sunil Devram Panchmatiya

Place: Jamnagar Date: September 06, 2022

Chairman and Managing Director DIN: 02080742



રોન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા सेन्ट्रल बैंक ऑफ़ इंडिया Central Bank of India 'CENTRAL' TO YOU SINCE 1911

BRANCH: RAIYA ROAD

[See Rule - 8 (1)] POSSESSION NOTICE (For Immovable Property)

The undersigned being the Authorized Officer of the Central Bank of India, Raiya Road_ under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12),13(2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 19/04/2022, calling upon the borrower Shri Pritesh Kumar B. Jagethiya, M/s. Vikash Impex and Guarantor Shri Bhagwatilal Nathulal Jagethiya to repay the amount mentioned in the notice being Rs. 40,96,946/- (In Words: Rs. Forty Lakhs Ninety Six Thousand Nine Hundred Forty Six Only) with in 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the borrowers/guarantors and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Enforcement Rules, 2002 on this 02nd day of August of the year 2022.

The borrowers/guarantors in particular and the public in general is hereby cautioned not to be deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India, Raiva Road for an amount Rs. 4096946 /- and interest thereon.(Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has given effect))

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All That Part And Parcel Of The Property Consisting Of Plot No. 82 Paiki In Survey No. 331-332-333 Paikicity With in The Registration Sub-district Raikot And District Rajkot. Boundaries:

On the North by : Property of vibhag No. 8 and distance to that side is 18.01 Mt. On the South by : Road of 50 ft. wide and distance to that side is 18.01 Mt. On the East by: Property of vibhag No. 5 and 6 and distance that side 44 Mt. On the West by : Property of vibhag No. 3 and distance that side is 44 Mt.

Date: 02.09.2022, Place : Rajkot

Sd/- Authorised Officer, Central Bank Of India



VISHAL FABRICS LIMITED

(CIN: L17110GJ1985PLC008206) Regd. Office: Ranipur Narol Road, Ahmedabad-382405 **Corporate Office:** Shanti Corporate House, Near Hira Rupa Hall, Bopal-Ambli Road, Ahmedabad-380058, Gujarat

Phone: +91 90999 52542 E-mail: cs.vfl@chiripalgroup.com; Website: www.vishalfabricsltd.com

NOTICE OF THE 37TH ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

- 1. Notice is hereby given that the 37th Annual General Meeting (AGM) of the Members of Vishal Fabrics Limited ("the Company") will be held on September 30, 2022 at 02:00 p.m. through Video Conference ("VC")/Other Audio Visual Means ("OAVM") facility in compliance with the applicable provisions of the:
 - Companies Act, 2013 ("the Act") and the Rules made thereunder, read with all applicable circulars issued by Ministry of Corporate Affairs ("MCA"); and
 - Securities and Exchange Board of India (Listing Obligations And Disclosures Requirement) Regulations 2015 ("Listing Regulations") read with all applicable circulars issued by the Securities and Exchange Board of India (SEBI)
- 2. The Annual Report for the Financial Year 2021-22 and the AGM Notice have been sent electronically to the Members whose e-mail IDs are registered with the Company Registrar and Transfer Agent / Depository Participants.
- 3. The Annual Report 2021-22 of the Company, inter alia, containing the Notice and the Explanatory Statement of the 37th AGM is available on the website of the Company at https://vishalfabricsltd.com/ and on the websites of the Stock Exchanges viz. www.bseindia.com

Pursuant to Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 the Company hereby informs that:

- 1. All the businesses as set out in the Notice of AGM may be transacted through remote e-
- 2. The remote e-voting period shall commence on Tuesday, 27th September, 2022 from IST 9:00 a.m. onwards and shall end on Thursday, 29th September, 2022 at IST 5:00 p.m. No Remote e-voting shall be allowed beyond the said date and time. The shareholders of the Company holding shares as on 23rd September 2022, (cut-off date) shall be entitled to cast their vote electronically according to the instructions mentioned in the AGM Notice to obtain his/her login id and password and the instructions on e-voting available in the Notice of AGM.
- 3. A member may participate in the AGM even after exercising his right to vote through Remote e-Voting, but shall not be allowed / entitled to vote again in the AGM. Once the vote on a resolution is cast by the Member through E-voting, he shall not be allowed to change it subsequently. In case the member's cast their vote by both the means then voting done through remote e-voting shall prevail.
- 4. In case shareholders/ members have any queries regarding e-voting, they may refer the Frequently Asked Questions ('FAQs') and InstaVote e-Voting manual available at https://instavote.linkintime.co.in, under Help section or send an email to enotices@linkintime.co.in or contact on: - Tel: 022 -4918 6000.

Book Closure

Date: 06/09/2022

Place: Ahmedabad

▲ इलाहाबाद

Suyash Flat

Name of the Borrower(s)

Amount of Secured debt

Earnest Money Deposit

Date and Time of e-Auction

Conditions, contact:

Date: 05.09.2022

Place: Ahmedabad

compliance Form with EMD amount

Mr. Sanjeev Kumar Thakur, Chief Manager

Ph.: 079-27432023, Mob.: 9427616303

zoahmedabad@indianbank.co.in

Reserve Price

Name of Guarantor/Mortgagor (s)

इंडियन बैंक 🤼 Indian Bank

The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday, September 24, 2022 to Friday, September 30, 2022 (both days inclusive) for the purpose of 37th AGM for the financial year 2021-22.

201-205, Memnagar, Ahmedabad-380052.

E-mail: zoahmedabad@indianbank.co.in

E-AUCTION ON 20.09.2022 AT 11.00 A.M. to 03.00 P.M.

UNDER SARFAESI ACT 2002 "AS IS WHERE IS, AS IS WHAT IS & WHATEVER THERE IS"

BASIS through e-auction platform provided at the website https://www.mstcecommerce.com

Mr. Patel Bharatkumar Jayramdas

Details of the Immovable property (Symbolic Possession)

B-202, Second Floor, Admeasuring 86.19 sq.mtrs of super built up area, Angat Residency, Survey No. 1/1, Paiki 1, T.P. Scheme No. 1, Near Alkapuri Society,

Ghatlodiya, Final Plot No 68, Mouje Ghatlodiya, Taluka Ghatlodiya, Dist. Ahmedabad

380061 within the state of Gujarat standing in the name of Mr. Patel Bharatkumar

Jayramdas and Mr. Patel Ravibhai Bharatbhai. The boundaries of the property are

: North : Maruti Society's House No. 09, South : T. P. Road, East : Super School, West :

Detail of encumbrance, Outstanding Dues There is no encumbrance on the property

of Local Govt, Electricity, Property tax, described herein to the best of knowledge Municipal Tax, etc. if any known to the Bank & information of the Authorized Officer.

(Guarantor)

expenses.

Last Date & time for Submission of Process On 19.09.2022 up to 4.00 P.M.

For further details and Terms & Fordownloading further details and Terms

Important note for the prospective bidders

Step 1 : Bidder/Purchaser Registration : Bidder to register on e-Auction portal (link

Step 2 : KYC Verification: Bidder to upload requisite KYC documents. KYC documents

Step 3: Transfer of EMD amount to his Global EMD Wallet: Online/off-line transfer of

Step 1 to Step 3 should be completed by bidder well in advance, on or before EMD date.

Note: This is also a notice to the borrower/guarantors/mortgagors of the above said loan about holding of this sale on the above mentioned date and other details.

given above) http://www.mstcecommerce.com using his mobile number and email-id.

E-mail: zoahmrecovery@indianbank.co.in, III. https://www.ibapi.in

shall be verified by e-auction service provider (may take 2 working days).

fund using NEFT/Transfer, using challan generated on e-Auction portal.

Bidder has to complete following formalities well in advance:

Rs. 38,25,000/-

E-auction through

10% of Reserve Price

(079) 27431248, (079) 27435663, 9724592936

Mr. Patel Bharatkumar Jayramdas

(Borrower & Mortgagor), 2. Mr. Patel

Mr. Patel Bharatkumar Jayramdas

(Borrower & Mortgagor), 2. Mr. Patel

Ravibhai Bharatbhai (Borrower),

Mrs. Patel Kanchanben Bharatkuma

(Guarantor), 4, Mrs. Patel Pinal Ravibhai

Rs. 24,12,179/- as per demand notice

dated 10.11.2021 Plus interest till the

date of realization & cost, charges & other

https://www.mstcecommerce.com Registration should be completed by

Intending bidder on or before EMD Date and

there should be EMD balance in global wallet. On 20.09.2022 Between 11.00 A.M to

03.00 P.M. with unlimited extension.

Bid Incremental Value is Rs. 10,000

https://www.mstcecommerce.com

Authorized Officer

Indian Bank

Place: Jaipur Date: 07-09-2022

& Conditions, please visit:

I. https://www.indianbank.in

Ravibhai Bharatbhai (Borrower),

For Vishal Fabrics Limited Sd/-Nikhil Vadera **Company Secretary**

IndiaRF

in respect of time available, to redeem the secured assets.

INDIA RESURGENCE ARC PRIVATE LIMITED

A Piramal Enterprises & San Marg, Lower Parel, Mumbai 400013.
Bain Capital Credit Partnership T: 022-68608500 / 68608501.CIN: U67190MH2016PTC272471 POSSESSION NOTICE (For Immovable Property) Whereas, the undersigned being the Authorized Officer of India Resurgence ARC Private Limited under


the Securitisation and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 13.02.2019 calling upon the Borrowers; Anand Ply Industries, Nileshkumar Babulal Patel, Damiyantiben D Patel, Navneetaben A Patel, Kalpnaben B Patel, Virendra Dahyabhai Patel, to repay the amount mentioned in the notices aggreg Rs.5,16,25,967.74 (Rupees Five Crore Sixteen Lakh Twenty-Five Thousand Nine Hundred Sixty Seven and Paisa Seventy Four Only) as on 13.02.2019 with further interest thereon as mentioned in the notice, till the date of payment and incidental expenses, costs, charges incurred / to be incurred less recovery within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Mortgagor / Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower / Mortgagor / Guarantors and the public in general that the undersigned has taken PHYSICAL possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of Act read with Rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 and in compliance of Hon'ble DM, Gandhinagar's order dated 03.02.2020 and substitution order dated 28.03.2022 under section 14 of the said Act on this the 5° day of September of the year 2022. The Borrower / Mortgagor / Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with property will be subject to the charge of the India Resurgance ARC Private Limited for an amount of Rs.8,84,63,489 (Rupees Eight Crore Eighty Four Lakh Sixty Three Thousand Four Hundred Eighty Nine only) as on 31.08.2022 with further interest thereon as mentioned in the notice, till the date of payment and incidental expenses, costs, charges incurred / to be incurred less recovery. The borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the SARFAESI Act,

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY All that piece and parcel of property bearing Nonagricultural Land admeasuring 7519 square meters along with construction admeasuring 4341 square meters at Survey No. 776, Paiki 2, Mouje Vadsar, Taluka Kalol, District Gandhi Nagar, in the registration Sub-District Kalol, bounded as under:

North: Open Land South: Open Land East: Approach Road West: Open Land Date: 05.09.2022 Authorized Officer India Resurgence ARC Private Limited Place: Vadsar, Kalol, Gandhinagar





Telephone: (0181) 2783112; Email: jil@jagatjit.com Website: www.jagatjit.com

NOTICE OF THE 77TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING

Notice is hereby given that the 77th Annual General Meeting (AGM) of the Company will be held on Friday, 30th September, 2022 at 10:30 A.M. through Video Conference ("VC")/ Other Audio Visual Means ("OAVM") in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules framed thereunder read with General Circular No(s) 14/2020 dated 8th April 2020, 17/2020 dated 13th April 2020, 20/2020 dated 5th May, 2020, 02/2021 dated 13th January, 2021 and 2/2022 dated 5th May, 2022, issued by the Ministry of Corporate Affairs (hereinafter collectively referred to as "MCA Circulars") and the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015 read with SEBI Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13th May, 2022 (hereinafter referred to as "SEBI Circular"), to transact the businesses as set out in the Notice of AGM.

In pursuance of the MCA Circulars and SEBI Circular, the Company has on 6th September, 2022 completed the dispatch of Notice of AGM and Annual Report for the financial year 2021-22, through electronic mode to those members whose email addresses are registered with the Company/ Depository Participant ("DP"). These documents are also available on Company's website www.jagatjit.com and website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com.

Pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 and Rules made thereunder and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirement) Regulations, 2015, the Register of Members and the share transfer books of the Company will remain closed from Monday, 26th September, 2022 to Friday, 30th September, 2022 (both days inclusive) for the

The Company will be providing its members the e-Voting facility before the AGM through remote e-Voting and voting at the AGM and the business set out in the notice of AGM may be transacted through e-voting. The Company has engaged the services of Central Depository Services (India) Limited (CDSL) as the agency to provide to the members, the facility of remote e-voting and the facility of attending AGM through VC/OAVM and e-voting at AGM. Members may attend the AGM through Video Conference ("VC")/ other Audio Visual Means ("OAVM"). The remote e-voting period commences at 9:00 a.m. on Tuesday, 27th September, 2022 and ends at 5:00 p.m. on Thursday, 29th September, 2022. The members who cast their vote by remote e-voting may participate in the AGM. However, they shall not be entitled to cast their vote again. Members participating in the AGM through VC/OAVM who have not cast their vote by remote e-voting shall be allowed to vote through e-Voting at the AGM.

Voting rights will be reckoned on the shares registered in the name of the Members as on 23rd September, 2022 (cut-off date). A person whose name is recorded in the register of members or beneficial owners as on cut-off date i.e. Friday, 23rd September, 2022, only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during AGM.

Members holding shares in physical form are requested to send duly completed Form ISR-

Members may register / update their email address by following the procedure mentioned below:

- along with requisite documents, at the Corporate Office of the Company at 4th Floor, Bhandari House, 91, Nehru Place, New Delhi - 110019 and provide the following details/documents for registering email address: a) Folio No., b) Name of shareholder, c) Email ID, d) Copy of PAN card (self-attested), e) Copy of
- Aadhar card (self attested) f) Copy of share certificate (front and back). Form ISR-1 is available on the website of the Company at www.jagatjit.com. ii) Members holding shares in demat form are requested to update their email id and mobile
- number with their respective Depository Participant (DP), which is mandatory while e-Voting and joining virtual meetings through Depository. For any assistance connected with the facility for voting by electronic means member may write

an email to helpdesk.evoting@cdslindia.com or contact at toll free No.1800225533. Members may also contact Mr. Roopesh Kumar, Company Secretary at roopesh.kumar@jagatjit.co.in. For and on behalf of

Jagatjit Industries Limited

Date: 6th September, 2022 Place: New Delhi

Roopesh Kumar Company Secretary



AAVAS FINANCIERS LIMITED (Formerly known as Au HOUSING FINANCE LIMITED) (CIN:L65922RJ2011PLCO34297) Regd. & Corp. Office: 201-202, 2nd Floor, South End Square, Mansarovar Industrial Area, Jaipur. 302020

AUCTION NOTICE

Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read wit proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of AAVAS FINANCIERS LIMITED (Formerly known as "Au HOUSING FINANCE LIMITED") Secured Creditor, will be sold on "As is where is"," As is what is ", and 'Whatever there is" basis. The details of the cases are as under.

Name of Borrowers/ Co-Borrowers/ Guarantors/Mortagors	Dues As on	Date & Amount of 13(2)Demand Notice	Date of Poss- ession	Description of Property	Reserve Price For Property	Earnest Money For Property	Date & Time of Auction	Place of Tender Submission, Tender Open & Auction at Aavas Financiers Ltd.
Bharatbhai Pratapbhai Patel, Mrs. Kamalaben Bharatbhai Patel Guarantor : Mr. Arvindbhai Jerambhai Sonavari (Ac No.) LNSUR02917- 180053260	Rs. 1,527,270.00/- Dues as on 02 Sep 2022	15 Apr 21 Rs. 1230917/- Dues as on 7 Apr 21	20/Apr /22	22, Harijan Vas, Hanuman Mandir Ni Agal, Dumas Road, Bhimpor, Surat, Gujarat -394550 Admeasuring 978 Sq. Ft.	Rs. 1509600/-	Rs. 150960/-	11.00 AM TO 01.00 PM 10 Oct 2022	301 & 305, REGENT SQUARE, ABOVE D- MART,ADAJAN, SURAT-395009, GUJARAT-INDIA
Firozalibhai Chhotalal Thobhani, Mrs. Shahenj Firojbhai Thobhani, Mrs. Gulbanu Thobhani Guarantor : Mr. Vimalkumar Chandulal Vora (Ac No.) LNRAJ00316- 170030561	Rs. 1,739,437.00/- Dues as on 02 Sep 2022	24 Mar 21 Rs. 1256028/- Dues as on 24 Mar 21	2/Mar /22	Revenue Survey No. 72 paiki, Digvijay Park, Plot No. 13 to 19, Flat No. B-201, Wing - B, 2nd Floor, Galaxy Twins Tower, Gram - Motavada, Ta Lodhika, District - Rajkot, Gujarat. Admeasuring Area 82.527 Sq. Mtrs.	Rs. 1111680/-	Rs. 111168/-	11.00 AM TO 01.00 PM 10 Oct 2022	905, 9TH FLOOR KING'S PLAZA, ASTRON CHOWK, RAJKOT-360001, GUJARAT-INDIA
Nathabhai Pababhai Haran, Mrs. Kunvarben Pababhai Haran Guarantor : Mr. Bharatbhai Nathabhai Bharai (Ac No.) LNJUN04017- 180057947	Rs. 1,178,221.41/- Dues as on 02 Sep 2022	3 Apr 21 Rs. 825254.41/- Dues as on 31 Mar 21	7/Apr/ 22	Revenue Survey No. 762 paiki, Sheet No. 32, City Survey No. 993/33 Paiki, Plot No. 32 Paiki, Village - Bhayavadar, Tal Upleta, District - Rajkot, Gujarat. Admeasuring 83.54 Sq. Mtr.	Rs. 812360/-	Rs. 81236/-	11.00 AM TO 01.00 PM 10 Oct 2022	OFFICE NO. 305,RAYINAGAR SHOPPING CENTER, MOTIBAG,JUNAG ADH-362001, GUJARAT-INDIA
Navrozbhai Hakimbhai Charaniya, Mrs. Samira Navrojbhai, Mr. Hakimbhai Charaniya Guarantor : Mr. Vimalkumar Vora (Ac No.) LNRAJ00316- 170030556	Rs. 1,800,645.41/- Dues as on 02 Sep 2022	24 Mar 21 Rs. 1294901.41/- Dues as on 24 Mar 21	2/Mar /22	Revenue Survey No. 72 paike, Plot No. 13 to 19, Flat No. 205, 2nd Floor, Galaxy Twins Tower, Wing - B, Mouje - Motavada, Ta Lodhika, District - Rajkot, Gujarat. Admeasuring Area 82.527 Sq. Mtrs. Builtup area.	Rs. 1111680/-	Rs. 111168/-	11.00 AM TO 01.00 PM 10 Oct 2022	905, 9TH FLOOR KING'S PLAZA, ASTRON CHOWK, RAJKOT-360001, GUJARAT-INDIA
Ramdevsinh Rupsinh Sarvaiya, Mrs. Ushaba Sarvaiya, Mr. Chhatrapalsinh Sarvaiya (Ac No.) LNRAJ00316- 170034809	Rs. 2,199,438.41/- Dues as on 02 Sep 2022	15 Apr 21 Rs. 1625386.41/- Dues as on 7 Apr 21	21/Ma r/22	Gondal Revenue Survey No. 383 Paiki 3, Sub Plot No. 45 To 54/14, Village - Gondal, Taluka - Gondal, District - Rajkot, Gujarat. Admeasuring 80.86 Sq. Mtrs.	Rs. 1529760/-	Rs. 152976/-	11.00 AM TO 01.00 PM 10 Oct 2022	905, 9TH FLOOR KING'S PLAZA, ASTRON CHOWK, RAJKOT-360001, GUJARAT-INDIA
Sahbudinbhai Chhotalal Thobhani, Mrs. Ashrafben Sahbudinbhai Thobhani, Mr. Aminbhai Shahabudin Thobhani, Mrs. Gulbanu Chhotalal Thobhani Guarantor: Mr. Vimalkumar Vora (Ac No.) LNRAJ00316- 170030555	Rs. 1,746,938.00/- Dues as on 02 Sep 2022	24 Mar 21 Rs. 1256028/- Dues as on 24 Mar 21	2/Mar /22	Revenue Survey No. 72 paiki, Digvijay Park, Plot No. 13 to 19, Flat No. B-203, Wing - B, 2nd Floor, Galaxy Twins Tower, Gram - Motavada, Ta Lodhika, District - Rajkot, Gujarat. Admeasuring Area 82.527 Sq. Mtrs. Builtup Area.	Rs. 1111680/-	Rs. 111168/-	11.00 AM TO 01.00 PM 10 Oct 2022	905, 9TH FLOOR KING'S PLAZA, ASTRON CHOWK, RAJKOT-360001, GUJARAT-INDIA

ferms & Conditions: 1). The person, taking part in the tender, will have to deposit his offer in the tender form provided by the AFL which is to be collected from the above branch office during working hours of any working day, super scribing "Tender Offer for name of the property "on the sealed envelope along with the Cheque/DD/pay order of 10% of the Reserve Price as Earnest Money Deposit (EMD) in favour of AAVAS FINANCIERS LIMITED payable at Jaipur on/before time of auction during office hours at the above mentioned offices. The sealed envelopes will be opened in the presence of the available interested parties at above mentioned office of AAVAS FINANCIERS LIMITED (Formerly known as "Au HOUSING FINANCE IMITED") The Inter-se bidding, if necessary will also take place among the available bidders. The EMD is refundable if the bid is not successful. 2). The successful bidder will deposit 25% of the bidding amount adjusting the EMD amount as initial deposit immediately or within 24hrs after the fall of the hammer towards the purchase of the asset. The successful bidder failing to deposit the said 25% towards initial payment, the entire EMD deposited will be forfeited & balance amount of the sale price will have to be deposited within 30 days after the confirmation of he sale by the secured creditor; otherwise his initial payment deposited amount will be forfeited. 3). The Authorised officer has absolute right to accept or reject any bid or adjourn/postpone he sale process without assigning any reason therefore. If the date of tender depositing or the date of tender opening is declared as holiday by Government, then the auction will be held on next working day. 4). For inspection and interested parties who want to know about the procedure of tender may contact AAVAS FINANCIERS LIMITED (Formerly known as "Au HOUSING FINANCE LIMITED") 201,202, IInd Floor, South End Square, Mansarovar Industrial Area, jaipur-302020 or Rakesh Kumar 9116650413 or respective branch during office hours. Note: This is also a 15/30 days notice under Rule 9(1)/8(6) to the Borrowers/Guarantors/Mortgagor of the above said loan accounts about tender inter se bidding sale on the above mentioned date. The property will be sold, if their out standing duesare not repaid in full.

Ahmedabad

Authorised Officer Aavas Financiers Limited





એસ્ટોન પેપર એન્ડ બોર્ડ મીલ લીમીટેડ

રજી. ઓફીસઃ ડી-७०૨, હમો માળ, ગણેશ મેરીડીયન, હાઈકોર્ટ સામે, એસ.જી. હાઈવે, અમદાવાદ-૩૮૦ ૦૬૦. ફોનઃ (079) 40081221, ફેક્સ: (079) 40081220, સીઆઈએન: L21090GJ2010PLC063428 **จัดสเยือ:** www.astronpaper.com **มิย์ต:** uttam_cs@astronpaper.com

૧૨મી વાર્ષિક સાધારણ સભા, રીમોટ ઈ-વોટીંગ માહિતી, કટ-ઓફ અને બુક બંધ તારીખ સંદર્ભની નોટિસ

આથી નોટીસ આપવામાં આવે છે કે, કોર્પોરેટ અફર્સ મંત્રાલયના તારીખ પમી મે, ૨૦૨૦ના રોજના પરિપત્રને તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦ના રોજના તેમજ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ના રોજના પરિપત્રની સાથે તેમજ સેબીના તારીખ ૧૨મી મે ૨૦૨૦ના રોજના પરિપત્રની સાથે વંચાણે લેતાં (સંયુક્ત રીતે આ બધાનો ઉલ્લેખ પરિપત્રો તરીકે કરાયો છે) તે અન્વયે એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મીલ લિમિટેડના સભ્યોની ૧૨મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ગુરૂવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ વાગે વિડિયો કોન્ફરન્સિંગ (વીસી) /અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમો (ઓએવીએમ) હારા યોજાશે અને તેમાં તારીખ oc ઓગસ્ટ, ૨૦૨૨ની એજીએમની નોટીસમાં દર્શાવાયા મુજબનું કામકાજ હાથ ધરાશે. ૧૨મી એજીએમની નોટીસ સાથે નાણાંકિય વર્ષ ૨૦૨૧–૨૨ માટેનો વાર્ષિક અહેવાલ સભ્યોને કંપની / ડીપોઝીટરીઝ પાર્ટીસીપન્ટસ પાસે રજીસ્ટર્ડ થયેલ ઇ-મેઇલ પર તારીખ ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ મોક્લવામાં આવ્યા છે અને તે ઉપરાંત કંપનીની વેબસાઈટ www.astronpaper.com ઉપર તથા સ્ટોક એક્સચેન્જીસની, અર્થાત બીએસઈ લિમિટેડની અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડની વેબસાઈટ્સ અનુક્રમે www.bseindia.com અને www.nseindia.com ઉપર પણ પ્રાપ્ત કરાયા છે તથા સેન્ટ્રલ ડીપોઝીટરી સર્વિસિઝ (ઈન્ડિયા) લિમિટેડની વેબસાઈટ www.evotingindia.com ઉપર પણ પ્રાપ્ત કરાશે.

વધુમાં, કંપનીઝ એક્ટ, ૨૦૧૩ની કલમ ૧૦૮ તથા સુધારા સહિતના કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ના રૂલ ૨૦ તેમજ સેબી (લીસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના નિયમન ૪૪નું પાલન કરતા, સભ્યોને એજીએમની નોટીસમાં દર્શાવ્યા મુજબના તમામ ઠરાવો ઉપર પોતાનો વોટ આપવા સીડીએસએલ દ્વારા પૂરી પાડવામાં આવતી ઈલેક્ટ્રોનિક વોટિંગ સીસ્ટમ (ઈ-વોટિંગ)નો ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી છે. ગુરૂવાર ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ (કટ-ઓફ તારીખ)ના રોજ કંપનીની ભરપાઈ થયેલી શેર મુંડીમાં સભ્યો જેટલા ઈક્વિટી શેર્સ ધરાવતા હોય તેના પ્રમાણમાં તેમના વોટિંગના અધિકારો રહેશે.

રીમોટ ઈ-વોટિંગનો સમયગાળો સોમવાર, રદ્દ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ વાગે (આઈએસટી) શરૂ થશે અને બુધવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ સાંજે ૫:૦૦ વાગે (આઈએસટી) પુરો થશે. આ સમયગાળા દરમિયાન, સભ્યો પોતાના વોટ ઈલેક્ટ્રોનિક્લી આપી શક્શે. રીમોટ ઈ-વોટિંગના માધ્યમથી વોટિંગ બુધવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ રોજ ૫:૦૦ વાગ્યા પછી કરવા દેવાશે નહીં. જે સભ્યો વીસી/ઓએવીએમ સવિધાના માધ્યમથી એજાએમમાં હાજર થયા હશે અને તેઓએ રીમોટ ઈ-વોટિંગથી પોતાના વોટ નહીં આપ્યા હોય તેમજ તેઓ વોટ આપવાથી વંચીત કરાયા ના હોય તેઓ એજાએમ દરમિયાન ઈ-વોટિંગના માધ્યમથી વોટ આપવાના અધિકારી રહેશે.

એજીએમ પહેલા જ રીમોટ ઈ–વોટિંગના માધ્યમથી પોતાના વોટ આપી દીધા હોય તે સભ્યો પણ વીસી/ઓએવીએમ સુવિધાના માધ્યમથી એજીએમમાં હાજર રહી શકશે/ભાગ લઈ શકશે, પણ તેઓ પોતાનો વોટ ફરીથી આપી શકશે નહીં. કટ–ઓફ તારીખના રોજ કંપનીના શેર્સ ધરાવતા હોય તેવા સભ્યોએ જ પોતાના વોટ આપવા. એજીએમની નોટીસ રવાના થઈ ગયા પછી કોઈપણ વ્યક્તિ કંપનીન સભ્ય બને અને કટ-ઓફ તારીખના રોજ તે શેર્સ ધરાવતા હોય, તેઓ એજીએમની નોટીસમાં દર્શાવવામાં આવેલી સુચનાઓ તથા ઈ–વોટિંગ/રીમોટ ઈ–વોટિંગની પધ્ધતિ અનુસરીને પોતાના વોટ આપી શક્શે. જે સભ્યોએ પોતાના ઈ-મેઈલ એડ્રેસીઝ નોંધાવ્યા ના હોય તેઓ અહીં નીચે દર્શાવ્યા મુજબની સૂચનાઓનું પાલન કરી શકે છે.

એ) ફિઝિકલ સ્વરૂપે શેર ધરાવતા સભ્યોને વિનંતી છે કે તેઓએ અમારી રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ એટલે કે લિન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને ahmedabad@linkintime.co.in પર અને કંપનીને uttam_cs@astronpaper.com પર ઈ-મેલ દ્વારા તેમની વિગત મોકલવા વિનંતી છે. જરૂરી વિગતો જેમ કે ફોલિયો નંબર, સભ્યનું નામ, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર, પાનકાર્ડની સ્વયં પ્રમાણિત નકલો અને એડ-પ્રુફ તેમની ઈ–મેલ આઈડી નોંધણી માટે.

બી) ડીમેટ સ્વરૂપે શેર ધરાવતા હોય તે સભ્યોને વિનંતી છે કે, તેઓએ પોતાના સંબંધિત ડીપોઝીટરી પાર્ટીસિપન્ટનો સંપર્ક કરી પોતાના ઈ-મેલ એડ્રેસીઝ નોંધાવી દેવા.

ઈ-વોટિંગ/રિમોટ ઈ-વોટિંગ મતદાન સંબંધિત વિગતો માટે, ફૂપા કરીને ૧૨મી એજીએમની નોટિસ જુઓ. ઈ-વોટિંગ/રિમોટ સંબંધિત કોઈપણ પશ્નો/ફરિયાદો હોય તો એ માટે તમે www.evotingindia.com પર સીડીએસએલની વેબસાઈટ પર ઉપલબ્ધ આવર્તન પૂછાચેલા પ્રશ્નો (FAQs) અને ઈ-વોટિંગ મેન્યુઅલ રીફર કરી શકો છો અથવા તો શ્રી રાકેશ દલબી, મેનેજર, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ, એ-વિંગ, ૨૫મો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મિલ કંપાઉન્ડ્સ, એન.એમ.જોશી માર્ગ, લોઅ૨ પરેલ (પૂર્વ), મુંબઈ–૪૦૦૦૧૩નો સંપર્ક કરી શકો છો. અથવા helpdesk.evoting@cdslindia.com ને ઈ-મેલ કરી શકો છો અથવા ૦૨૨–૨૩૦૫૮૭૩૮ પર અથવા ૦૨૨–૨૩૦૫૮૫૪૨ પર અથવા ૦૨૨–૨૩૦૫૮૫૪૩ ઉપર કામકાજના તમામ દિવસોએ સંપર્ક કરી શકો છો.

કંપની એક્ટ, ૨૦૧૩ની કલમ-૯૧ ને આધિન રહી, એ પણ નોટિસ આપવામાં આવે છે કે કેપનીના સભ્યોનું શેર રજીસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ શુક્રવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ થી ગુરૂવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ (બંને દિવસો સહિત) કંપનીની ૧૨મી વાર્ષિક સાધારણ સભાના હેતુથી બંધ રહેશે.

એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મીલ લિમીટેડ વતી,

તારીખ: ૦૬.૦૯.૨૦૨૨ સ્થળ: અમદાવાદ

ઉત્તમ પટેલ કંપની સેક્રેટરી

તારીખ અને માગણા

તારીખ : ૦७/૦૯/૨૦૨૨

સ્થળ : રાજકોટ

કરજદાર /સહ-કરજદાર /જામીનદારના નામ,

ઈન્ફિનિટી ફિનકોર્પ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ

રજિસ્ટર્ડ ઓફિસઃ એ-૫૦૭, બિલ્ડિંગ ઍનું લેવલ ૫, ૨૧૫-એટ્રિયમ, ૧૫૧ SANKALP AAPKA. SAATH HUMARA અંધેરી કુર્લા રોડ, ચકાલા, અંધેરી (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૯૩

મિલ્કતનું વર્ણન

સરફેસ એક્ટ ૨૦૦૨ના એસ.૧૩ (૨) હેઠળ સિક્યુરિટાઇઝેશન નોટીસ

ઇન્ફિનિટી ફિનકોર્પ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (હવેથી તેને ''આઇએફએસપીએલ'' તરીકે ઓળખાશે) અધિકૃત અધિકારી દ્વારા કાર્ય કરે છે, આથી **ઇન્ફિનિટી ફિનકોર્પ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ** હેઠળ વિષયની નોટીસ આપે છે. નીચે દર્શાવેલ રકમ માટે નીચેના ગ્રાહકો દ્વારા વિનંતી અને રજુઆતના આધારે લોનની સુવિધા આપી હતી અને કરારની શરતો મુજબ જે મિલકત સામે લોન લેવામાં આવી હતી તે મિલ્કત સમાન ગીરો દ્વારા સિક્ચોર કરવામાં આવી હતી.

લોન એકાઉન્ટ નં. અને એનપીએ તારીખ	भिस्डतनु वर्धन	નોટીસ ૧૩(૨)ની રક્રમ	
 ૧) શ્રી. વિજય રામજીભાઇ ખલાસી મુ:- ૯ - ૧૦ આત્મીય પાર્ક સોસાયટી, ગોતમી કન્યા વિદ્યાલય પાસે, અમરોલી ઉતરાણ, ચોરાસી, સુરત-૩૯૪૧૦૦, ગુજરાત. તેમજ, મુ:- પ્લોટ નંબર કર, નિર્મલ નગર સોસાયટી, માનસરોવર સર્કલ પાસે, અમરોલી, સુરત- ૩૯૪૧૦૦, ગુજરાત ૨) એયક્ષાબેન વિજયભાઇ ખલાસી મુ:- ૯-૧૦-આત્મિયા પાર્ક સોસાયટી, ગોતમી કન્યા વિદ્યાલય પાસે, અમરોલી ઉતરાણ, ચોરાસી, સુરત - ૩૯૪૧૦૦, ગુજરાત. ૩) શ્રી. કમલેશભાઇ રામજી ખલાસી મુ:- ૯-૧૦-આત્મિયા પાર્ક સોસાયટી, ઉતરાણ અમરોલી, અમરોલી, ગોતમી કન્યા વિદ્યાલય પાસે, ચોરાસી, સુરત - ૩૯૪૧૦૦, ગુજરાત. ૪) પૂર્વા એન્ટરપ્રાઇઝ દુકાન નં. ડી - ૧૧, ગ્રાઉન્ડ ફ્લોર શ્રીનાથઝી કોમ્પલેક્સ, ન્યુ કોસાડ રોડ, અમરોલી, સુરત-૩૯૪૧૦૦, ગુજરાત. લોન એક્લઉન્ટ નંબર: INSURLR0000180 એનપીએ તારીખ: ૧૦/૦૦/૨૦૨૨ 	પ્લોટ નં-દરનો તમામ પાર્સલ, ૭૦ ચો.યાર્ડ એટલે કે પટ.પર ચો.મી. સાથે દર.૧૭ ચો.મી. બાંધકામ, "નિર્મલ નગર" માં, રેવન્યુ સર્વે નંબર ૧૩/૧ અને ૧૩/૨ પર સ્થિત, ટી.પી. સ્કીમ નં.૭૦ (છપ્રભાથા-અમરોલી-કોસાડ), ફાઈનલ પ્લોટ.૨૧૫, મોજે અમરોલી, સુરત શહેર, વિજય રામજીભાઈ ખલાસીનો છે. ચતુંસીમાઓ : પૂર્વ : રંગ લક્ષ્મી સોસાચટી, પશ્ચિમ : સોસાચટી રોડ, ઉત્તર : પ્લોટ નં. ૬૧, દક્ષિણ : પ્લોટ નં. ૬૩	રક/૦૮/૨૦૨૨ રૂ.૨૦,૦૪,ક૨૫/- (અંકે રૂપિયા વીસ લાખ ચાર હજાર છસો પચ્ચીસ પુરા) તેની સાથે કરાર અનુસાર ૨૬/૦૮/૨૦૨૨ થી અત્યાર સુધીના ભવિષ્ના વ્યાજની સમગ્ર પરત ચૂકવણી સાથે	
 ૧) શ્રી અશ્વમેઘ ટ્રાન્સપોર્ટ મુ:- બ્રામ્હણી કોમ્પ્લેક્સ, ક્રિષ્ઠા બોચઝ હોસ્ટેલ પાસે, આજીકેમ ચોક્કી, રાજકોટ- ૩૬૦૦૦૨, ગુજરાત ૨) મહેશ નવલભાઈ ગઢવી મુ: - જલારામ કૃપા, વાણીચા વાકી સ્ટ્રીટ, રાજકોટ-૩૬૦૦૦૧, ગુજરાત ૩) હીરાબેન નવલભાઈ ગઢવી મુ:- જલારામ કૃપા, વાણીચા વાકી શેરી, રાજકોટ-૩૬૦૦૦૧, ગુજરાત. લોન એકાઉન્ટ નંબર: INRAJLR0001275 એનપીએ તારીખ: ૧૯/૦૮/૨૦૨૨ 	રાજકોટ રેવન્યુ સર્વે નંબર ૩૩૮/પી, ટીપીએસ નં.પ પર સ્થિત પ્લોટ નં. ૨/૨ ના પ૪-૨-૦ ચોરસ યાર્ડ જમીનનો વિસ્તાર ૪૫-૩૧ ચોરસ મીટર એટલે કે ૫૪-૨-૦ ચોરસ યાર્ડ ધરાવતા રહેણાંક મકાનની સ્થાવર મિલકતનો તે તમામ ભાગ અને પાર્સલ. પ, એફપી નં. ૧૮૮, સિટી સર્વે રાજકોટ વોર્ડ નં. ૮, સબ-જિલ્લા અને ૨જી.માં સિટી સર્વે નં. ૧૧૦૨. જિ. રાજકોટ યર્તુસીમાઓ : પૂર્વ : અન્ય મિલક્ત, પશ્ચિમ: અન્ય મિલક્ત, ઉત્તર: અન્ય મિલક્ત,	રક/૦૮/૨૦૨૨ રૂ.૨७,७૯,૦૯૩/- (અંકે રૂપિયા સત્તાવીસ લાખ ઓગણાએંશી હજા ત્રાણું પુરા) તેની સાથે કરાર અનુસાર ૨૬/૦૮/૨૦૨૨ થી અત્યાર સુધીના ભવિષ્ના વ્યાજની સમગ્ર પરત ચૂકવણી સાથે	

કરારના નિયમો અને શરતો મુજબ, તમે ઉપરોક્ત કરજદારો જ્યારે અને ત્યારે તે બાકી નીકળતી ત્યારે સમાન માસિક હપ્તાની ચુકવણી કરીને લોન એકાઉન્ટને નિયમિત રાખવાની જરૂર હતી. જો કે, ઉપરોક્ત લોન સુવિધાના સંબંધમાં ખાતાઓની કામગીરી અને આચરણ અનિયમિત થઈ ગયું છે અને તેથી **ઇન્ફિનિટી ફિનકોર્પ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ** ને આરબીઆઇની પ્રક્રિયા મુજબ તમારા ખાતાને એનપીએ તરીકે વર્ગીકૃત કરવાની ફરજ પડી છે. હવે આઇએફએસપીએલ તમને સરફેસી એક્ટ, ૨૦૨૦ની કલમ ૧૩ (૨) હેઠળ મળેલી સત્તાની રુએ અત્યારની તારીખથી ૬૦ દિવસના સમયગાળાની અંદર બાકી રહેલી કુલ ૨કમ અને તેના પરના વ્યાજ અને તેમાં સામેલ અન્ય ખર્ચાઓની ચુકવણી કરવા માટે જણાવે છે. આમાં નિષ્ફળ જતા, આઇએપએસપીએલને તમામ અથવા કોઈપણ એક અથવા વધુ સિક્ચોર્ડ મિલ્કતો સામે, આ કાયદાની જોગવાઈઓને અનુરૂપ આશ્રય લેવાની ફરજ પડશે જેનો સંપૂર્ણ ખર્ચ અને પરિણામો તમારા જોખમે રહેશે.

ઉપરોક્ત કાયદાની જી. ૧૩ (૧૩)ની જોગવાઈઓના સંદર્ભમાં, આ નોટીસમાં ઉલ્લેખ કર્યો છે તે અનુસાર અમારા ગ્રાહકની પૂર્વ સંમતિ વિના તમને આથી, વેચાણ, લીઝ અથવા અન્યથા (તમારા વ્યવસાયની સામાન્ય પ્રક્રિયા સિવાય) કોઈપણ સિક્ચોર્ડ મિલ્કતને સ્થાનાંતરિત કરવા માટે પ્રતિબંધિત ફરમાવવામાં આવે છે.

RPAD દ્વારા મોકલવામાં આવેલી નોટિસની બજવણી થઇ ન હતી, તેથી તેની નકલ તેમના ઘરે ચોંટાડવામાં આવી છે અને પેપરમાં પ્રકાશિત કરવામાં આવી છે.

ઈન્ફિનીટી ફિનકોર્પ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમીટેડ ક્થળઃ ગુજરાત

તારીખઃ ૦૬/૦૯/૨૦૨૨

અધિકૃત અધિકારી કમલેશકુમાર શાહ



બેંક ઓફ મહારાષ્ટ્ર

ઝોનલ ઓફિસ સુરત : બીજો માળ, માઈલસ્ટોન ફિયેસ્ટા, એલ.પી. સવાણી રોડ, અડાજણ, સુરત - ૩૯૫૦૦૯, ફોન : (૦૨૬૧) ૨૭૩૦૫૨૦, **ઇમેલ** : dzmsurat@mahabank.co.in



પઝેશન નોટીસ (ਰਿચਮ - ૮(૧))

આથી **બેંક ઓફ મહારાષ્ટ્ર** ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્શીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ અને સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમ ૨૦૦૨ની કુલમ ૧૩ ની પેટા કુલમ ૧૨ ના નિયમ ૮ સાથે વચાણે લેતાં મળેલ સત્તાની 3એ (૧). કીમાન્ડ નોટીસ તા. ૩૦.૦૫.૨૦૨૨ ના રોજ ઉધારકર્તાઓ શ્રીમતી જાગૃતિબેન ધર્મેન્દ્રકૂમાર વ્યાસ અને શ્રી ધર્મેન્દ્રકૂમા ભરતકુમાર વ્યાસ (ઉદ્યારકર્તાઓ), (૨). ડીમાન્ડ નોટીસ તા. ૨૧.૦૩.૨૦૨૨ ના રોજ ઉદ્યારકર્તાઓ શ્રી સંજય આનંદ રાવ વાદ્ય (ઉદ્યારકર્તા) અને શ્રી ઈન્દ્રજીત ઉદયસિંહ મન્ડેય (જામીનદાર), (૩). ડીમાન્ડ નોટીસ તા. ૧૪.૦૨.૨૦૨૨ ના રોજ ઉધારકર્તાઓ શ્રી ધવલ રાજારામ પવાર અને શ્રી શિલ્પા **દાવલ પવાર (ઉદારકતાંઓ) અને શ્રી જીતેન્દ્રકુમાર રમેશભાઈ ભોઈતે (જામીનદાર)** ને કુલ રકમ સાથે ડીમાન્ડ નોટીસ મળ્યાના ૬૦ દિવસમાં ભરવા માટે

ઉધારકર્તાઓને ડીમાન્ડ નોટીસ રજી. એડી થી મોકલીને બેંકના બાકી લ્હેણાં ભરવા જણાવેલ. ઉધારકર્તાઓ ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તાઓ તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમની કલમ ૧૩ની પેટા કલમ (૪) તથા ઉક્ત નિયમો હેઠળના નિયમ ૮ અંતર્ગત મળેલ સત્તાની રૂએ અધોહસ્તાક્ષરકર્તાએ **તા. ૦૨.૦૯.૨૦૨૨** માટે નિમ્નલિખિત મિલકતોનો **સાંકેતિક કબજો** લઇ લીધો છે.

ઉધારકર્તાને ખાસ કરીને તેમજ જાહેર જનતાને સામાન્ય રીતે સૂચિત કરવામાં આવે છે કે સદરહુ મિલકતોની કોઈપણ જાતની લેવડ દેવડ કરવી નહી અને કોઈપણ જાતની લેવડ-દેવડ કરવામાં આવશે તો **બેંક ઓફ મહારાષ્ટ્ર** નો ઉપર જણાવેલ સ્ક્રમના બોજા સહિત રહેશે.

		ક્શાવર ામલસ્વાની વઠાન			
ક્રમ તાં.	ઉદ્યારકર્તાઓ / જામીનદારોનું નામ	સિક્યોર્ડ એસેટ્સનું વર્ણન (સ્થાવર મિલકત)	રક્રમ		
۹.	શ્રીમતી જાગૃતિબેન ધર્મેન્દ્રકુમાર વ્યાસ અને શ્રી ધર્મેન્દ્રકુમાર ભરતકુમાર વ્યાસ (ઉદારકર્તાઓ)	તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકતનો ફ્લેટ નં. સી-૩૦૩, ત્રીજો માળ, બિલ્ડીંગનો ટાવર - સી, ''પલાસ હાઈટ્સ એપાર્ટમેન્ટ્સ'' ના નામનો પ્રોજેક્ટ, કાર્પેટ એરીયાનું આશરે ક્ષેત્રફળ ૫૧.૧૬ સ્કે.મી., બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રફળ ૮૪.૪૪ સ્કે.મી., આર.એસ. નં. ૫૭૮, ૫૭૯, ગામ - વડોદરા, જીલ્લો - વડોદરા, ગુજરાત.	લેજર બેલેન્સ રૂા. ૧૮,७૩,૪૮૨.૫૦ + નહીં લાગુ કરેલ રૂા. ૫૪,૪૫૫.૪૪ વત્તા તા. ૩૧.૦૫.૨૦૨૨ ના રોજ થી ૭.૪૫% લેખે વ્યાજ		
ર.	શ્રી સંજય આનંદ રાવ વાદા (ઉદ્યાસ્કર્તા) અને શ્રી ઈન્દ્રજીત ઉદયસિંહ મન્ડેય (જામીનદાર)	તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકતનો ફલેટ નં. એફ-૩/૪૫૬, ત્રીજો માળ, વૈકુંઠધામકો. ઓ. હાઉસીંગ સોસાયટીલિ., મોજે -વડસર, આર.એસ. નં. ૨૭૩, ૨૭૪, બીન ખેતીલાયક જમીનનો એફ.પી. નં. ૩૯૯, માંજલપુર, સર્વે નં. ૪૪૦, ૪૪૧, ૪૪૨, બીન ખેતીલાયક જમીનનો એફ.પી. નં. ૨૪૭, સબ જીલ્લો -વડોદરા, ગુજરાત.	લેજર બેલેન્સ રૂા. ૫,૦૮,૧૮૩.૮૨ + નહીં લાગુ કરેલ રૂા. ૩૮,૫૯૧.७७ વત્તા ७.૩૦% લેખે વાર્ષિક વ્યાજ અને ૨% લેખે પીનલ વ્યાજ		
3.	શ્રી ઇવલ રાજરામ પવાર અને શ્રી શિલ્પા ઇવલ પવાર (ઉધારકર્તાઓ) અને શ્રી જીતેન્દ્રકુમાર રમેશભાઈ ભોઈતે (જામીનદાર)	તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકતનો કલેટ નં. જી-૨૦૧, જેનું આશરે ક્ષેત્રફળ ૬૫.૩૭૨ સ્કે.મી., શ્રી હરી રેસીડેન્સી, બાંધકામ કરેલ જમીનનો રેવન્યુ સર્વે નં. ૮૩, મોજે - તરસાલી, તાલુકો અને જીલ્લો - વડોદરા, ગુજરાત, કાપોદરા - બારડોલી રોડ, મોજે-બગુમરા, તાલુકો-પલસાણા, જીલ્લો-સુરત - ૩૯૪૩૦૫.	લેજર બેલેન્સ રૂા. ૧૦,૪૮,૩૨७/- + નહીં લાગુ કરેલ રૂા. ૬૬,૫૮૮/- વત્તા ७.૩૦% લેખે વાર્ષિક વ્યાજ અને ૨% લેખે પીનલ વ્યાજ		
નોંધ : (વિવાદ ની સ્થિતીમાં અંગ્રેજી					

એડ-શોપ ઇ-રીટેઇલ લિમીટેડ

(અગાઉ એડ-શોપ પ્રમોશન્સ લિમીટેડ ના નામે જાણીતી) સી.આઇ.એન. નં.: L51109GJ2013PLC076482

રજીસ્ટર્ડ ઓફીસઃ બી-૩૦૪, ઇમ્પીરીયલ હાઇટસ્, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૫, ગુજરાત (ભારત) ટેલીફોન નં.: 0281-2363023 ઇ-મેઇલ : info@addshop.co વેબસાઇટ: www.addshop.co

આથી નોટિસ આપવામાં આવે છે કે એડ-શોપ-ઇ-રીટેઇલ લિમીટેડ (''કંપની'')ના સભ્યો ની ૯મી (નવમી) વાર્ષિક સાધારણ સભા ("એજીએમ") ગુરૂવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૨ના રોજ બપારેનાં ૦૩.૦૦ વાગ્યે વીડીયો કોન્ફરન્સીંગ ("વીસી") / અન્ય ઓડીયો વીઝ્યુઅલ માધ્યમો (''ઓએવીએમ'') મારફત એજીએમની નોટિસમાં નિર્ધારીત કરેલ કામકાજ હાથ ધરવા માટે યોજવામાં આવશે. કંપની ધારો, ૨૦૧ ૩ને કોર્પોરેટ બાબતોનાં મંત્રલાય દ્વારા જારી કરાયેલ સામાન્ય પરિપત્રો તા.મે ૦૫, ૨૦૨૦, એપ્રિલ ૮, ૨૦૨૦ અને એપ્રિલ ૧૩,૨૦૨૦ અને સેબી દ્વારા જારી કરાયેલ પરિપત્ર મે ૧૨,૨૦૨૦ અને અન્ય લાગુ પડતા કાયદાઓનું પાલન કરીને એજીએમ માત્ર વીસી /ઓએવીએમ મારફત જ યોજવામાં આવશે એજીએમ માટે પ્રોક્સીની નિમણૂંક કરવાની સવલત ઉપલબ્ધ કરાવાશે નહીં. એજીએમમાં ઇલેક્ટ્રોનિકલી જોડાવાની સુચનાઓ એજીએમની નોટિસમાં આપેલ છે.

વાર્ષિક સાધારણ સભા (હવે પછીથી એજીએમ તરીકે ઓળખાશે) બોલાવવાની નોટિસ જે સભ્યોનાં ઇમેઇલ આઇડી કંપની , ડીપોઝીટરી પાર્ટિસીપન્ટ્સ/રજીસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ(આરટીએ) પાસે રજીસ્ટર્ડ થયેલ છે તેઓને ઇ-મેઇલથી મોકલેલ છે. કંપનીએ તેનાં તમામ સભ્યોને ઇ-મેઇલથી નોટિસ મોકલવાની / રવાના કરવાની કાર્યવાહી તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરેલ છે અને તે કંપનેને વેબસાઇટ <u>www.addshop.in</u> પર પણ મુકેલ છે . કોઇ સભ્ય નોટિસની નકલની સોફ્ટ કોપી મેળવવા ઇચ્છતા હોય તેઓએ તેમની હોલ્ડીંગની વિગત જેવી કે નામ, ફોલીઓ નંબર, સર્ટિફીકેટ નંબર, ડીપી આઇડી, ક્લાયન્ટ આઇડી વિગેરે સ્પષ્ટપણેં દર્શાવીને <u>investors@addshop.co</u> પર ઇમેઇલથી કંપનીને મોકલવા.

કંપનીએ ઇ-વોટિંગની સવલત પુરી પાડવા અને વીડીયો કોન્ફરન્સીંગ (વીસી) મારફત એજીએમ નું સંચાલન કરવા માટે અધિકૃત એજન્સી તરીકે સીડીએસએલ ની સેવા રોકેલ છે. જે સભ્યનું નામ, કટ-ઓફ-તારીખ એટલે કે બુધવાર, સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૨ના રોજ, કંપનીનાં સભ્યોનાં રજીસ્ટર માં અથવા ડીપોઝીટરીઝ દ્વારા જાળવવામાં આવતા લાભકર્તા માલિકોનાં રજીસ્ટરમાં નોંધાયેલ હશે તેઓજ રિમોટ ઇ-વોટિંગની તેમજ એજીએમ દરમ્યાન ઇ-વોટિંગની સવલત માટે લાયક ગણાશે. રિમોટ ઇ-વોટિંગનો પ્રારંભ સોમવાર, સપ્ટેમ્બર ૨૬, ૨૦૨૨ના રોજ સવારનાં ૦૯.૦૦ વાગ્યે (ભારતીય પ્રમાણભૂત સમય) થશે અને બુધવાર, સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૨ના રોજ સાંજના ૦૫.૦૦ વાગ્યે (ભારતીય પ્રમાણભૂત સમય) પુરૂ થશે. જે સભ્યોએ તેમનો મત રિમોટ ઇ-વોર્ટિંગથે એજીએમ અગાઉ આપ્યો હોય તેઓ મીટીંગમાં વીસી / ઓએવીએમ મારફત ભાગ લઇ / હાજર રહી શકશે પરંતુ ફરીથી મત આપવા માટે લાયક ગણાશે નહિ. કટ-ઓફ તારીખ એટલે કે, બુધવાર, સપ્ટેમ્બર ૨૧, ૨૦૨૨ના રોજ સભ્યોનાં મત આપવાનાં અધિકાર કંપનીની કુલ ચુકવણી કરેલ શેરની મુડીમાં તેમના હિસ્સાનાં પ્રમાણમાં હશે. કંપનીનાં સભ્યોનું રજીસ્ટર અને કંપનીની શેર ટ્રાન્સફર બુક ગુરૂવાર, સપ્ટેમ્બર ૨૨, ૨૦૨૨ થી ગુરૂવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૨ (બન્ને દિવસો સહિત) બંધ રહેશે.

જે સભ્યોએ એજીએમની નોટિસ, ઇમેઇલથી, મોકલ્યા બાદ પરંતુ કટ-ઓફ ડેટ પહેલા શેર પ્રાપ્ત કર્યા હોય તેઓ helpdesk.evoting@cdslindia.com પર મેઇલ મોકલીને વિનંતી કરીને તેમનો યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવા. કંપનીએ રિમોટ ઇ-વોટિંગ પ્રક્રિયા અને ૯મી એજીએમ દરમ્યાન ઇલેક્ટ્રોનિક વોટિંગને ચકાસણી માટે સ્ક્રુટીનાઇઝર તરીકે

મે.જી.આર.શાહ એન્ડ એસોસીએટ, કંપની સેક્રેટરી, અમદાવાદની નિમણુંક કરેલ છે, મતદાન<u>નું</u> જાહેર કરેલ પરિણામ, સ્ક્રુટીનાઇઝરનાં અહેવાલ સહિત, કંપનીની વેબસાઇટ <u>www.addshop.in</u> પર મુકવામા આવશે અને

બીએસઇ લિમીટેડને પણ જણાવામાં આવશે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સનાં હુકમથી એડ-શોપ-ઈ-રીટેઇલ લિમીટેડ વતી,

નિરજકુમાર માલવિયા કંપની સેક્રેટરી (એસીએસ ૬૦૩૩૩)

THOMAS COOK (INDIA) LIMITED

Regd. Office: Thomas Cook Building, Dr. D.N. Road, Fort, Mumbai - 400 001 Tel.: +91-22-4242 7000 | Fax: +91-22-2302 2864 | Website: www.thomascook.in **Toll-Free No.:** 1800-2099-100 | **Email:** sharedept@thomascook.in **CIN:** L63040MH1978PLC020717

NOTICE OF 45TH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 45th Annual General Meeting (AGM) of the Members of Thomas Cook (India imited ('the Company') will be held on Wednesday. September 28, 2022 at 3:30 p.m. IST through Video Conferencing ('VC')/ Other Audio Visual Means ('OAVM'), to transact the business as set out in the Notice o AGM, in Compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and rules made thereunder, read with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2020 dated May 5, 2020, General Circular No. 02/2021 dated January 13, 2021, General Circular No. 21/2021 dated December 14, 2021 and General Circular No. 02/2022 dated May 5, 2022 (collectively referred to as "MCA Circulars") and Securities and Exchange Board of India ("SEBI" Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, Circular No SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and Circular No SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 (collectively referred to as "SEBI Circulars"), which permitted the holding of the AGM through VC/OAVM, without the physical presence of the Members at a common venue

The Notice of AGM and the Annual Report for the financial year 2021-22, inter-alia, containing Board's Report Auditors' Report and Audited Financial Statements for the financial year ended March 31, 2022, have beer sent/is being sent on Tuesday, September 6, 2022 in electronic mode, to all those Members who have registered their email addresses with the Company/ Registrar & Share Transfer Agent ("RTA")/ Depository Participants. Members may note that the Notice of AGM and the Annual Report will also be available on the website of the Company at www.thomascook.in, Central Depository Services (India) Limited ('CDSL') at <u>www.evotingindia.com</u>, BSE Limited at <u>www.bseindia.com</u> and National Stock Exchange of India Limited at <u>www.nseindia.com</u>. The Physical copy of the Notice along with the Integrated Annual Report for FY 2021-22 shall be sent to those Members, who request for the same at sharedept@thomascook.in mentioning their Names, Folio Number/ DP ID and Client ID.

The Members can attend and participate in the AGM through VC/OAVM only. The detailed instructions with respect to such participations are provided in the Notice of the AGM.

Instructions for remote e-voting and e-voting at the AGM

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, and Secretarial Standard on General Meetings (SS-2 issued by the Institute of Company Secretaries of India, Members are provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of the AGM using electronic voting system ('remote e-voting'), provided by CDSL. The detailed instructions for remote e-voting and e-voting at the AGM are given in the notes to the

Notice of the AGM. Members are requested to note the following:					
1)	Cut-off Date for determining the eligibility of Members for	Wednesday, September 21, 2022			
	voting through remote e-voting and voting at the AGM				
2)	Day, date and time of Commencement of remote e-voting:	Sunday, September 25, 2022			
		(9:00 a.m. IST)			
3)	Day, date and time of end of remote e-voting	Tuesday, September 27, 2022			
		(5:00 p.m. IST)			

The remote e-voting module shall be disabled by CDSL for voting thereafter and Members will not be allowed to vote electronically beyond the said date and time

Members holding shares either in physical form or dematerialised form as on the cut-off date of Wednesday September 21, 2022 shall be entitled to remote e-voting. Electronic voting shall also be made available and Members attending the AGM who have not cast their vote through remote e-voting shall be able to vote at the AGM through e-voting. Members who have cast their vote through remote e-voting prior to the AGM can attend the AGM but shall not be entitled to cast their vote again. Once the vote on a resolution is cast by the Membe

the Member shall not be allowed to change it subsequently. Any person, who acquires equity shares of the Company and becomes a Member of the Company after dispatch of the Notice and holding shares as on the cut-off date, may cast their votes by sending request for your existing User ID and Password for casting your vote. If you forget your password, you can reset you password by using "Forgot User Details /Password" option available on www.evotingindia.com or contact CDSI at toll free no. 1800225533.

For details relating to remote e-voting, please refer to the Notice of the AGM. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, 'A' Wing, 25th Floor, Marathon FutureX, Mafatlal Mills Compounds, N.M. Joshi Marg, Lower Parel (E), Mumbai – 400013 at the designated email ID: helpdesk.evoting@cdslindia.com or at toll free no.: 1800225533

For Thomas Cook (India) Limited

Place: Mumbai Amit J. Parekh Date: 6th September, 2022 Company Secretary & Compliance Office

OSBI ભારતીય સ્ટેટ બેંક

કભોકા શાખા (૦૨૬૪૦), મો. ७૬૦૦૦૩૮૪૬૬.

Appendix 4 - [RULE - 8 (1)] કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

માથી, નીચે સહી કરનાર **સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા - આરબીઓ-૧, ગાંધીનગરના** અધિકૃત ખધિકારીશ્રીએ સીકચોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઑફ ફાયનાન્શીયલ એસેટ્સ એન્ડ બેન્ફોર્સમેન્ટ ઑફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અંતર્ગત અને સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) અંતર્ગત આપવામાં આવેર્લ મત્તાની રૂએ **તા. ૦૨.૦૪.૨૦૨૨** ના રોજ કરજદાર/જામીનદાર/માલિક **શ્રી મણીલાલ જીવરા**મ <mark>શવળ</mark> ને ડિમાન્ડ નોટિસમાં દર્શાવેલી રકમ **રૂા. ૧૦,૬૮,૦૮૧.૦૦ (રૂપિયા દસ લાખ અકસઠ હજાર એક્ચાંસી માત્ર**) તા. ૦૨.૦૪.૨૦૨૨ સુધીના એબીએલ એકાઉન્ટ નં. 38542835023 અંતર્ગત તેનીસાથે લાગુ વ્યાજ, કોષ્ટ, ચાર્જીસ વગેરે + નલગાડેલ વ્યાજ અને અવાસ્તવિક વ્યાજ અને અ રકમ પર કોન્ટ્રાકચ્ચુલ દરે ચડત વ્યાજ આકિષ્મક ખર્ચા, કોસ્ટ્સ, ચાર્જીસ વગેરે રકમ, જે હોય સાથે

કરજદાર/ભાગીદારો/જામીનદારો બાકી રકમ ચુકવવામાં કસુરવાર થતાં કરજદાર, કાનૂની મારસદારો (જાણીતા–અજાણ્યા), કાનૂની પ્રતિનીધી (જાણીતા – અજાણ્યા), જામીનદાર અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે ઉક્ત અધિનિયમની ધારા ૧૩(૪) સાથે જણાવેલ નિયમો સાથે વંચાતા નિયમ ૮ હેઠળ મળેલ સત્તાની રૂએ નીચે સહી કરનારે નીચે જણાવેલ **મિલકતનો સાંકેતિક**

સદર નોટીસ જારી થયાના ૬૦ દિવસમાં ચુકવવા જણાવેલ હતું.

કબજો તા. ૨૬.૦૮.૨૦૨૨ ના રોજ લઈ લીધેલ છે. કરજદાર/ભાગીદારો/જામીનદારો, કાનૂની વારસદારો (જાણીતા–અજાણ્યા), કાનૂની પ્રતિનીધી (જાણીતા – અજાણ્યા), જામીનદાર અને જાદેર જનતાને સૂચિત કરવામાં આવે છે કે સદરહું મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર કરવો નહીં ને જો આ મિલકત સાથે કોઈપણ જાતનો વ્યવહાર થશે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રૂા. ૧૦,૬૮,૦૮૧.૦૦ (રૂપિયા દસ લાખ અડસઠ હજાર એક્યાંસી માત્ર) તા. ૦૨.૦૪.૨૦૨૨ સુધીના એબીએલ એકાઉન્ટ નં. 38542835023 અંતર્ગત તેનીસાથે લાગુ

''સદરહુ કાચદાની કલમ ૧૩ ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે કરજદાર/ભાગીદારો/ જામીનદારો/ગીરોદારોનું મુકરર મિલકત છોડાવવા માટે મળવાપાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.''

વ્યાજ, કોષ્ટ, ચાર્જીસ વગેરે + નલગાકેલ વ્યાજ અને અવાસ્તવિક વ્યાજ અને આ રકમ પર

કોન્ટ્રાકચ્યુલ દરે ચડત વ્યાજ આકિષ્મક ખર્ચા, કોસ્ટ્સ, યાર્જીસ વગેરે, જે હોય સાથે બોજાને આધીન

મિલકતનું વિવરણ

હાઉસીંગ નં. – ૨૯, ક્ષેત્રફળ ૯૮.૬૬ સ્કે. મીટર્સ, શ્રી હરી બંગલોઝ, જમીન સર્વે નં. ૨૧૩૦, એફ.પી. નં. ૧૪૧), ટી.પી. સ્કીમ નં. ૦૨, મોજે દહેગામ, તાલુકા – દહેગામ, ગાંધીનગર ની મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે. ઉત્તરઃ બંગલો નં. – ૨૫, દક્ષિણઃ સોસાયટી રોડ પૂર્વઃ બંગલો નં. – 30, પશ્ચિમઃ સોસાયટી રોડ

તા. : ૨૬.૦૮.૨૦૨૨ સ્થળ : ગાંધીનગર

સહી/- અધિકૃત અધિકારી ભારતીય સ્ટેટ બેંક – RB0-1 - ગાંધીનગર

પૂજાવેસ્ટ્રર્ન મેટાલિક્સ લિમિટેડ

સીનઃ Lર७૩૨૦GJ૨૦૧۶PLC૦૯૪૩૧૪ રજી. ઓફિસઃ પ્લોટ નં. ૧, ફેઝ ૨, જીઆઇડીસી, ડારેડ, જામનગર, ગુજરાત-૩૬૧૦૦૪, (ભારત) ટેલ. નં.: ૨૮૮-૨૭૩૦૦૮૮, વેબસાઇટ: www.poojametal.com ઇમેઇલ: poojametals@gmail.com

કંપનીની 06મી વાર્ષિક સામાન્ય સભા અને ઈ-વોટિંગની સૂચના

નોટિસ આથી આપવામાં આવે છે કે સતત કોવિડ-19 રોગયાળાને ધ્યાનમાં રાખીને અને 5 મે, 2020ના પરિપત્ર નં. 02/2022 અનુસાર, 05 મે, 2022ના પરિપત્ર નં. 2022/02 સાથે વાંચવામાં આવેલ પરિપત્ર નં. 14 એપ્રિલ, 8. , 2020 અને પરિપત્ર નં. 17 તારીખ 13 એપ્રિલ, 2020 અને પરિપત્ર નં. 02/2021 તારીખ 13 જાન્યુઆરી, 2021ના "વીડિયો કોન્ફરન્સિંગ (VC) અથવા અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો (OAVM)) દ્વારા વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજવા અંગેની સ્પષ્ટતા" (ત્યારબાદ સામૂર્ફિક રીતે "MCA પરિપત્રો" તરીકે ઓળખાય છે) દ્વારા જારી કરવામાં ઓવી હતી. VC અથવા OAVM દ્વારા વાર્ષિક સામાન્ય સભા યોજવા માટે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ("MCA"), પૂજાવેસ્ટર્ન મેટલિક્સ લિમિટેડના સભ્યોની છઠ્ઠી (6ઠ્ઠી) વાર્ષિક સામાન્ય સભા (AGM) ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2022 ના રોજ 1200 P.M. વાગ્ચે યોજાશે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ("VC") / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો ("OAVM") 6ક્રી એજીએમની નોટિસમાં દર્શાવ્યા મુજબ સામાન્ય અને વિશેષ વ્યવસાયોનો વ્યવહાર કરવો.

05 મે, 2022ના સામાન્ય પરિપત્ર નં. 02/2022 અનુસાર, 8 એપ્રિલ, 2020ના સામાન્ય પરિપત્ર નં. 14/2020, તા. 13 એપ્રિલ, 2020ના સામાન્ય પરિપત્ર નં. 17/2020 અને સામાન્ય પરિપત્ર નં. 02/ 2021 તારીખ 13 જાન્યુઆરી, 2021, કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ અને પરિપત્ર નંબર SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તારીખ 12 મે, 2020 અને પરિપત્ર નંબર SEBI/HO/CFD/CMD2/ CIR/P/2022/62 તારીખ 13 મે, 2022 ના રોજ સિક્ચોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા જારી કરાચેલ AGM ની નોટિસ વાર્ષિક અહેવાલ 2021-22 સાથે ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા ફક્ત તે સભ્યોને મોકલવામાં આવે છે જેમના ઈમેલ એડ્રેસ સાથે નોંધાંચેલ છે. કંપની/ડિપોઝિટરીઝ. સભ્ય નોંધ લે કે નોટિસ અને વાર્ષિક અहેવાલ 2021-22 કંપનીની વેબસાઇટ www.poojametals.com પર, BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) એટલે કે વેબસાઇટ www.evoting.nsdl.com પર અપલોડ કરવામાં

એમસીએ પરિપત્રોના પ્રકાશમાં, શેરધારકો ડીમેટ સ્વરૂપે અથવા ભૌતિક સ્વરૂપમાં ઇક્વિટી શેર ધરાવે છે અને જેમણે તેમના ઇમેઇલ સરનામાં સબમિટ કર્યા નથી અને પરિણામે જેમને 06મી એજીએમ અને વાર્ષિક અહેવાલ 2021-22ની નોટિસ આપી શકાઈ નથી, તેઓ અસ્થાયી રૂપે સેવા આપી શકે છે. નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને તેમના ઈ-મેલ સરનામાં રજીસ્ટર કરાવો:

1. જો શેર ભૌતિક સ્થિતિમાં રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને ફ્રેલિયો નંબર, શેરધારકન નામ. શેર પમાણપત્રની સ્કેન કરેલી નકલ (આગળ અને પાછળ). PAN (પાન કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ), આધાર (આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત સ્ક્રેન કરેલી નકલ.info@poojametal.com પર ઇમેઇલ દ્વારા મોકલો.

જો શેર ડીમેટ મોડમાં રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને DPID-CLID (16 અંકનો DPID + CLID અથવા 16 અંકનો લાભાર્થી ID), નામ, ક્લાયન્ટ માસ્ટર અથવા કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની કૉપિ. PAN (PAN કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કૉપિ) આધાર (આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલ) info@poojametal.com પર મોકલો.

વૈકલ્પિક રીતે સભ્ય ઇ-મેઇલ વિનંતી મોકલી શકે છે evotina@nsdl.co.in પર કેસ તરીકે પોઇન્ટ (1) અથવા (2) માં ઉલ્લેખિત વિગતોને સાબિત કરીને વપરાશકર્તા ID અને પાસવર્ડ મેળવવા માટે.

ઈ-મેલ એડેસની સકળ નોંધણી પછી. શેરધારકને 06મી એજએમ અને વાર્ષિક અઠેવાલ 2021-22ની નોટિસની સોક્ટ કોપી અને 06મી માટે ઈ-વોટિંગ સક્ષમ કરવા માટે યઝર-આઈડી અને પાસવર્ડ સાથે ઈ-વોટિંગ માટેની પુક્રિયા મળશે. એજએમ. કોઈપણ પુશ્નોના કિસ્સામાં. શેરધારક કંપનીને info@pooiametal.com પર પત્ર લખી શકે છે. શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ડિપોઝિટરી સહભાગીઓ (ઓ) સાથે તેમના ઈમેલ આઈડીની નોંધણી/અપડેટ કરે કે જેમની સાથે તેઓ તેમના . ડીમેંટ એકાઉન્ટ્સ જાળવી રાખે છે, જો જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને શેર ડીમટીરિયલાઈઝડ મોડમાં રાખવામાં આવ્યા હોય. ગુરુવાર, સપ્ટેમ્બર 22, 2022 ("કટ-ઓફ તારીખ") ના રોજ જે સભ્યોના નામ સભ્યોના

રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ દ્વારો જાળવવામાં આવેલા લાભદાચી માલિકોના રજિસ્ટરમાં નોંધાચેલા છે, તેઓ ફક્ત દૂરસ્થ ઇ-ની સુવિધા મેળવવા માટે હકદાર હશે. વાર્ષિક સામાન્ય સભામાં મતદાન તેમજ ઈ-વોટિંગ.

કંપની અધિનિયમ, 2013 ની કલમ 108 ની જોગવાઈઓને અનુસરીને તે ફેઠળ બનાવેલા નિયમો (સુધાર્યા પ્રમાણે) અને સેબી (LODR) રેગ્યુલેશન્સ, 2015 (સુધારેલા મજબ) ના નિયમન 44 અને ઉપરોક્ત એમસીએ પરિપત્રો સાથે વાંચવામાં આવે છે. કંપની રિમોટની સુવિધા પૂરી પાડે છે. ઇ-વોટિંગ અને એજીએમની તારીખે ઇ-વોટિંગ તેના સભ્યોને એજીએમમાં વ્યવહાર કરવાના વ્યવસાયના સંદર્ભમાં. આ ફેત્ માટે, કંપનીએ ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનની સુવિધા માટે NSDL સાથે કરાર કર્યો છે. રિમોટ ઈ-વોટિંગ સોમવાર, 26 સપ્ટેમ્બર, 2022 ના રોજ સવારે 9:00 વાગ્યે શરૂ થશે અને બુધવાર, સપ્ટેમ્બર 28, 2022 ના રોજ સાંજે 5:00 વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, કટ-ઓફ તારીખે શેર ધરાવનાર કંપનીના સભ્યો ઈલેક્ટ્રોનિક

રીતે તેમનો મત આપી શકે છે (રિમોટ ઈ-વોટિંગ). સભ્યો તેની નોંધ લે. a) મતદાન માટેની ઉપરોક્ત તારીખ અને સમય પછી NSDL દ્વારા રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલને અક્ષમ કરવામાં આવશે અને એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મત આપવામાં આવે, પછી સભ્યને તેને બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં;

ઈ-વોટિંગની સુવિધા 06મી એજીએમમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, અને જે સભ્યોએ 06મી એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે તેઓ પણ 06મી એજીએમમાં હાજરી આપી શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો મત આપવા માટે હકદાર રહેશે નહીં. રિમોટ ઈ-વોટિંગ/ઈ-વોટિંગ માટેની વિગતવાર

પક્રિયા 06મી વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર મેળવે છે અને એજીએમની નોટિસ મોકલ્યા પછી કંપનીના સભ્ય બને છે અને કટ-ઓફ તારીખ એટલે કે ગુરુવાર, સપ્ટેમ્બર 22, 2022ના રોજ શેર ધરાવે છે. તેમને એજાએમની નોટિસનો સંદર્ભ લેવા વિનંતી કરવામાં આવે છે.

વોટ આપવા માટે USER ID અને પાસવર્ડ મેળવવા માટેની પૃક્રિયા અપનાવવામાં આવશે ઈ-વોટિંગ માટે કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, તમે શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અને www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ શેરધારકો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર પર કૉલ કરી શકો છો. : 1800-222-990 અથવા evoting@nsdl.co.in પર વિનંતી મોકલો. સભ્યો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં કંપનીના કંપની સેક્રેટરી શ્રી તેજુસ

રમેશયંદ્ર પિઠાડીયાનો પણ સંપર્ક કરી શકે છે અથવા કોઈપણ વધુ સ્પષ્ટતા માટે www.pooiametals.com. પર ઈ-મેલ લખી શકે છે. સભ્યો VC/OAVM સુવિધા દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી શકે છે અને તેમાં ભાગ લઈ શકે છે. VC/0AVM દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચનાઓ વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. જો શેરધારકો/સભ્યોને એજીએમમાં ભાગ લેવા અંગે કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય, તો તમે

evoting@nsdl.co.in પર ઈમેલ લખી શકો છો અથવા અમને ટેલિફોન: 1800-222-990 કૉલ કરો. કંપની અધિનિયમ, 2013 ની કલમ 103 ફેઠળ કોરમની ગણતરીના ફેતુઓ માટે VC/0AVM દ્વારા મીટિંગમાં હાજર રહેલા સભ્યોની ગણતરી કરવામાં આવશે.

પૂજાવેસ્ટર્ન મેટાલિક લિમિટેડ વતી, એસડી ⁄-સુનીલ દેવરામ પંચમતીયા

स्थाणः श्वामनञार તારીખ: ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ ચેરમન અને મેનેજિંગ ડિરેક્ટર ડીન: 02080742